https://archive.org/details/bk1152/page/n0/mode/1up

1981-12 -Jagruti (1152)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

શ્રી કચ્છ કડવા પાટીદાર
સનાતન સમાજ યુવક
મંડળ તરફથી

સેવા, સંગઠન અને સંસ્કારનો ઉચ્ચ
આદર્શ રજુ કરતું પ્રાણવાન માસિક

જાગૃતિ

*

॥ શ્રી ઉમિયાય નમઃ ॥

તંત્રી : કાન્તિલાલ કે. પટેલ બી. એ.

વર્ષ : ૨૩ અંક-૧૨ ડીસેમ્બર-૧૯૮૧

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk1152/page/n2/mode/1up

1981-12 -Jagruti (1152)

realpatidar.com

શ્રી કચ્છ કડવા પાટીદાર
સનાતન સમાજ યુવક
મંડળ તરફથી

સેવા, સંગઠન અને સહકારનો ઉચ્ચ
આદર્શ રજુ કરતું પ્રાણવાન માસિક

જાગૃતિ

*

॥ શ્રી ઉમિયાય નમઃ ॥

તંત્રી : કાન્તિલાલ કે. પટેલ બી. એ.

વર્ષ : ૨૩ અંક-૧૨ ડીસેમ્બર-૧૯૮૧

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n3/mode/1up

realpatidar.com

卐 જાગૃતિ 卐

• માસિકના નિયમો *

- દર અંગ્રેજી માહનાની ૧૫મી તારીખે પ્રગટ થશે.
- વાર્ષિક લવાજમ દેશમાં રૂા. ૧૨), પરદેશમાં શિલિંગ ૨૪ અને છૂટક નકલ કિંમત રૂા. ૧-૨૫ આજીવન સભ્ય ફી દેશમાં રૂા. ૨૦૧) પરદેશમાં રૂા. ૩૫૧) નવા ગ્રાહકોનું લવાજમ તા. ૧લી જાન્યુઆરીથી અથવા તા. ૧લી જૂનથી ચાલુ રાખવામાં આવશે.
- પત્ર–વ્યવહાર કરતી વખતે ગ્રાહક નંબર તેમજ પોતાનું પુરેપુરૂં સરનામું લખવું જરૂરી છે.
- કોઈ પણ લેખ વિશેની જવાબદારી લેખ મોકલનારના શિર પર રહેશે.
- લેખ હમેશાં સારા અને સુવાચ્ય અક્ષરે કાગળની એક બાજુ લખી મોકલવા.
- લેખ પરત મેળવવા ઇચ્છતા લેખકોએ જવાબી ટીકીટ ખર્ચ આપવાનું. રહેશે.
- કોઈપણ લખક ભાઈ અગર બહેન પોતાનો લેખ છપાવવો જ જોઈએ એવો આગ્રહ રાખી શકશે નહિ.
- દરેક ગ્રાહક મિત્રે તેમનાં બાકી રહી ગયેલાં લવાજમો વહેલી તકે મોકલી આપે.
- "જાગૃતિ" આજીવન સભ્ય તેમજ જૂના કે નવા વાર્ષિક ગ્રાહકો જેમને માસિક નિયમિત ન મળતું હોય, સરનામું બરાબર ન હોય, અગર બીજું કંઇ પણ સૂચન હોય તો કાર્યાલય પર તુરત જ પત્ર લખી જણાવે તેવી નમ્ર વિનંતી છે.

સંપાદક મંડળ :

શ્રી વિશ્રામભાઇ એન. પટેલ –પ્રકાશક

શ્રી. કાન્તિભાઈ કે. પટેલ –તંત્રી
બી એ.

શ્રી. વાડીભાઈ કે. પટેલ M. A. B. Ed
સહતંત્રી : જાગૃતિ

: સંપાદકો :

શ્રી. રતિભાઈ એલ. પટેલ M. Sc.
તલોદ.

શ્રી અરજણભાઇ વી. પટેલ, એદલપુરાકંપ

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n4/mode/1up

realpatidar.com

આદ્ય સુધારક અને પાટીદાર સમાજને જાગૃત કરનાર

પટેલ નારાયણભાઈ રામજીભાઈ લીંબાણી

[વીરાણી-કચ્છ]

જન્મ :
સંવત ૧૯૩૬ વૈશાખ પૂર્ણિમા

સ્વર્ગવાસ :
સંવત ૧૯૯૭ આસો વદ ચૌદસ

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n5/mode/1up

realpatidar.com

અનુક્રમણિકા

અ.નં.	લેખ	લેખક કે સંપાદક	પૃષ્ઠ
૧	તંત્રી સ્થાનેથી...	કાન્તિલાલ કે. પટેલ	૧
૨	નૂતન વર્ષના સત્સંકલ્પો...	નટવરલાલ કે. પટેલ	૩
૩	ગરીબની અમીરાઈ	જયરામભાઈ પી. પટેલ	૪
૪	સમાચાર દર્શન	—	૫ થી ૧૬

ગ્રાહક મિત્રો

આપના બાકી નીકળતાં લવાજમો મોકલી આપી તેમજ રૂા. ૨૦૧/- અંકે એક રૂપિયા ભરી આજીવન સભ્ય બનીને સહાયક બનવા નમ્ર વિનંતી.

realpatidar.com

realpatidar.com

તંત્રીસ્થાનેથી

સૂર્યોપાસના

સુર્ય એ ફક્ત આકાશમાંનો જડ ગોળો નથી. પરંતુ વિશ્વનો, જીવમાત્રનો પ્રાણ છે. એ પ્રચંડ તેજનો ગોળો તો સમગ્ર સૃષ્ટિની ધારણા છે, વનસ્પતિનો આધાર છે. તેના વગર જીવનનો વિચાર જ અશક્ય છે. સુર્ય વગર જીવન સંભવી જ શકતું નથી. સમગ્ર સંસાર તેનો ઋણી છે.

'सूर्य आत्मा जगतस्तस्थुषश्च ।' .— (ઋગ્વેદ)

'સુર્ય એ સ્થાવર જંગમ સૃષ્ટિનો આત્મા છે.'

માનસશાસ્ત્રનો નિયમ એ છે કે માનવ જેનું ચિંતન કરે છે તેવો તે થાય છે. સતત શ્રીનું ચિંતન કરનાર સ્ત્રૈણ બને છે; જડનું ચિંતન કરનારમાં જડતા પ્રવેશે છે. આપણા પૂર્વજોએ તેજઃપુંજ સહસ્ર–રશ્મિની ઉપાસના કરી અને પોતાનું જીવન તેજસ્વી તેમજ પ્રતિભાસંપન્ન બનાવ્યું.

સુર્ય એ માનવનો મિત્ર છે. તેથી તો मित्राय नमः કહીને ઋષિઓએ તેની વંદના કરી હતી. 'पापान्निवारयति योजयते हिताय' એ દૃષ્ટિએ સાચો મિત્ર તે જ કે જે પાપમાંથી આપણને છોડાવે અને હિતકારક કાર્યમાં જોડે આ અર્થમાં સુર્ય એ આપણો ખરો મિત્ર છે, તે આપણને પાપથી દૂર કરે છે. માણસ અંધકારમાં જેટલો પાપ કરવા પ્રેરાય છે તેટલો પ્રકાશમાં પ્રેરાતો નથી. વળી સુર્ય એ ભગવાનની આંખ છે, જેની મારફત ભગવાન આપણા બધા જ જીવન વ્યવહારો નિહાળે છે. આ

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n7/mode/1up

realpatidar.com

સમજણથી પણ માનવ પાપ કરતો અટકે છે. જુના કાળના લોકો પોતાના ઘણા કાર્યો સુર્યની સાક્ષીએ કરતા હતા. તેનું પણ આજ રહસ્ય હોવું જોઈએ. વળી સુર્ય ઊગતાં જ માનવ કર્મપ્રવૃત્ત બને છે. આ રીતે માનવને આળસ તેમજ પ્રમાદના પાપમાંથી છોડાવી, હિતકારી કર્મયોગમાં જોડાનાર સુર્ય જેવો અનુપમ મિત્ર કયો હોઇ શકે ?

સુર્ય આપણને વીજળીના ગોળાની માફક માત્ર પ્રકાશજ નથી આપતો પરંતુ તેજ, ઉષ્મા, ઊર્જા અને જીવન પણ આપે છે. તેથીજ ઋષિઓએ તેને સુર્યનારાયણ ભગવાન કહીને બિરદાવ્યો છે. આપણા શરીરમાં ૯૮·૪° ડિગ્રી ઉષ્ણતામાન રહે તે માટે સુર્ય કેટલો બળતો રહે છે ! જેના સતત બળવાથી વિશ્વની ધારણા થાય છે તેને કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર એ જ માનવની ખાનદાની છે.

સુર્ય પૃથ્વીને ઘણું બધું આપે છે પરંતુ જો કેવળ આપ્યા જ કરે અને કંઈ લે નહીં તો પૃથ્વીમાં લઘુતાગ્રંથિ (Inferiority complex) નિર્માણ થાય; તેથી સુર્ય પૃથ્વી પાસેથી પોતાને જરૂર ન હોવા છતાં પણ પૃથ્વીના સમાધાન માટે પાણી લે છે અને પાછું તેને મીઠું બનાવીને વરસાવે છે. આપનારાએ લેનાર પાસેથી પણ કંઈક લેવું જોઈએ; અને એ રીતે તેનું ગૌરવ ટકાવવું જોઈએ; એ વાત સુર્ય કેવી સહજ રીતે સમજાવે છે. કૃષ્ણે કદાચ તેથી જ સુદામા પાસેથા પહેલાં તાંદુલ લીધાં હશે અને પછી તેને સોનાની સુદામાપુરી આપી હશે.

સુર્ય એ મહાન કર્મયોગી છે, કર્મયોગીઓનો આદર્શ છે, પ્રેરણા છે. સાચો કર્મયોગી સાધનોની પરિમિતતા પર રડતો બેસતો નથી પરંતુ તે પોતાના સત્વથી કાર્ય સાધી લે છે આટલો અવિરત કર્મયોગ કરનાર સુર્યની પાસે શ્રેષ્ઠ સાધનોનો સદંતર અભાવ છે.

એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યુ છે કે, ' સુર્યના રથને એક જ પૈડું છે, સાપની લગામથી સંયમિત થયેલા સાત ઘોડાઓ છે, આલંબન વગરનો માર્ગ છે પગ વગરનો સારથિ (અરૂણ) છે. સાધનોની આટલી બધી મર્યાદા છતાં સુર્ય રોજ સમગ્ર આકાશમાં ફરી વળે છે કારણ કે મહાપુરૂષોની કાર્યસિદ્ધિ તેમના સત્વ પર નિર્ભર છે નહી કે સાધનો પર '

—સંસ્કૃતિ પૂજનમાંથી સાભાર.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1152/page/n8/mode/1up

realpatidar.com

* નૂતન વર્ષના સત્સંકલ્પો.... *

નટવરલાલ કે. પટેલ F. Y. B. Com રૂપાલકંપા.

- શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મસંયમ અને નિયમિતતાથી આરોગ્યનું રક્ષણ કરીએ.
- મનને જીવનનું કેન્દ્રબિંદુ માની તેને સ્વચ્છ રાખીએ.
- આપણું રોજિંદુ જીવન એજ આપણું મંદિર, આપણો આરાધ્યદેવ અને આપણો ધર્મ છે.
- આપણે પોતાને સમાજનું એક અભિન્ન અંગ સમજી બધાના હિતમાં હિત સમજીશું.
- ઇશ્વરને સાચો માર્ગદર્શક બનાવી મનને હમેશાં પવિત્ર રાખવા પ્રયત્ન કરીએ.
- કુવિચારો તથા દુર્ભાવનાઓથી તેને બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીએ.
- ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સાદાઇ અને સજ્જનતાનું વાતાવરણ બનાવીશું
- પરંપરાની તુલનામાં વિવેકને મહત્ત્વ આપીએ.
- ઇમાનદારી અને મહેનતની જ કમાણી સ્વીકારીએ.
- આપણે નારાજ થઇએ તો પણ જે આપણા તરફ નારાજ ન થાય એવા માણસની મિત્રતા જ કરીએ.
- સાધના, સ્વાધ્યાય, સંયમ, અને સેવા કાર્યોમાં આળસ તથા પ્રમાદ થવા દઇશું નહિ.
- અનીતિ થી મળેલી સફળતા કરતાં નીતિ પર ચાલતાં મળેલી નિષ્ફળતાને માથે ચડાવીએ.
- આપણને ખુદને જે પસંદ નહિ હોય તેવું વર્તન બીજા સાથે નહિ કરીએ.
- સદ્દગુણોને સાચી સંપતિ સમજીને વ્યકિતગત જીવનમાં નિરંતર વધારતા રહીએ
- જેવા છીએ એવાજ દેખાવું કોઇનું અનુકરણ ન કરવું કે અસ્વાભાવિક ન બનવું એમાં જ સરવાળે લાભ છે.
- પ્રતિવ્રતાધર્મ તથા પત્નીવ્રત ધર્મનું શ્રધ્ધાથી પાલન કરીએ.
- ખરાબ વિચારો દૂર કરી શુધ્ધ, પવિત્ર વિચારો ગ્રહણ કરી આપણા જીવનનું ધ્યેય સાકાર કરીએ.
- મનમાં શુધ્ધ સંકલ્પો કરવા જોઇએ અને મનને સત્સંગ કે પ્રભુ ભક્તિમાં લગાડવું જોઇએ.

જય યોગેશ્વર

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n9/mode/1up

realpatidar.com

✻ ગરીબની અમીરાઈ

જયરામભાઇ પી. પટેલ
ઉમિયા પ્રિન્ટરી હિંમતનગર

ઉનાળો ધીખી રહયો હતો. બળબળતો બપોરનો સમય હતો રેલગાડી બહુચરાજી તરફ દોડી રહી હતી. રસ્તામાં દેવલીનું નાનકડું સ્ટેશન આવ્યું.

પાણી...પાણી...કરતી એક બાર–તેર વર્ષની છોકરી માથે ઘડો લઇને સ્ટેશનના પ્લેટ ફોર્મ ઉપર ઉતાવળી ઉતાવળી ઘૂમી રહી હતી. બે માઇલ દૂર થી તે પાણી લઇને દરરોજ સ્ટેશન પર રેલ્વેના ટાઇમે આવતી અને મુસાફરોને પાણી પાઇને ચાર આઠ આના જે મળે તે લઇને તેનો લોટ ખરીદી ઘેર જતી.

એક મુસાફર ભાઇ એ બે લોટા પાણી લીધું ને પોતાના કુટુંબના તરસ્યા માનવીઓને થોડું થોડું પાયું, પાણી વાળી આ છોકરીને આ મુસાફરે પચીસ પૈસા આપ્યા.

પણ આ છોકરીએ ફકત દસ પૈસા લીધા અને બીજા વધારાના પૈસા પાછા આપ્યા.

પેલા મુસાફરે ફરીથી આગ્રહ પૂર્વક કહયું લઇ લેને બહેન હું રાજી થઇને આપુ છું. ને ?

ના કાકા ના એમ હરામનું નો લેવાય.

બંને વચ્ચે ભારે રકઝક ચાલી છોકરી અડગ રહી પરસેવો પાડીને જીવતી આ અભણ ગરીબ નાની બાળામાં પણ કેટલી બધી પ્રામાણિકતા હતી.

એક ગરીબ અબુધ માનવીમાં કેટલી બધી અમીરાઇ હતી આજે લાખોની કમાણી કરનારા શાહસોદાગરોમાં પણ આટલી પ્રામાણિકતા કયાંય દેખાય છે ? પુસ્તકોના ગંજમાં રાચતા વિદ્વાનોમાંય આવી પ્રામાણિકતાનાં દર્શન થાય છે ખરાં ?

મને તો એમજ થાય છે કે જેણે નિશાળનું પગથીયું ય નથી જોયું એવી આ અભણ બાળામાં આ ઉમદા સંસ્કાર કયાંથી ઉતર્યા હશે.

આજે અપ્રામાણિકતાને રોકવા કાયદા–કાનૂન થી પગલાં લેવાઈ રહયાં છે ત્યારે પ્રામાણિકતાથી પરસેવો પાડીને જીવનારાં લાખો ગરીબ અભણ માનવીઓ પ્રામાણિકતાની મશાલ લઇને ખડાં છે–જરા તેમના તરફ તો જુઓ.

કોનામાં નૈતક મૂલ્યો છે ? આ પાણી પાનારી અભણ ગરીબ છોકરીમાં કે અપ્રામાણિકતાથી અઢળક ધન પેદા કરનારા વેપારી અને બુધ્ધિજીવીઓમાં ?

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n10/mode/1up

realpatidar.com

'સ્નેહમિલન' તથા 'સરસ્વતી સમારોહ' ના

-✻ અહેવાલ ✻-

ગત તા. ૨૮-૧૦-૮૧ બુધવારના નૂતન વર્ષના શુભ દિને મંડળનું સ્નેહ-મિલન તથા સરસ્વતી સમારોહ પાટીદાર સમાજવાડી મધ્યે યોજવામાં આવેલ.

સમારોહનું વિધિવત સંચલન શરૂ કરતાં સૌ પ્રથમ માનદ મંત્રીશ્રી રતનશી લધારામ પટેલે ઉપસ્થિતિ લગભગ ૩૦૦ ભાઇ-બહેનોનું હાર્દિક સ્વાગત કરતાં નવ.વર્ષની શુભ કામનાઓ વ્યકત કરેલ.

મંડળના વડીલ સભ્યશ્રી સામજીભાઇ કરશન પટેલે સમારોહ-પ્રમુખ તરીકે તેમજ ભાઇશ્રી મણીભાઈ પટેલે પ્રમુખશ્રીનું સ્થાન શોભાવેલ અતિથિવિશેષનું સ્થાન ભાઇશ્રી બાબુલાલ નારાયણભાઇ પટેલે સ્વીકારેલ.

સરસ્વતિ સમારોહમાં સ્કુલ ફાઇનલ તેમજ હાયર સેકન્ડરીની પરીક્ષાઓમાં ઉતિર્ણ થયેલ ૧૬ વિદ્યાર્થિભાઇયો તેમજ ૧ વિદ્યાથિની બહેનને સમારોહ પ્રમુખ શ્રીના વરદ હસ્તે "સન્માન પત્ર" તેમજ આકર્ષક ઇનામો એનાયત કરવામાં આવેલ મુખ્ય વકતાઓમાં મંડળના ઉપ-પ્રમુખશ્રી તુલસીભાઇ, સહમંત્રીશ્રી રણછોડભાઇ કોષાધ્યક્ષશ્રી નારણભાઇ સહિત અન્ય સક્રિય સભ્યે એ તથા મહિલા મંડળના મંત્રી શ્રીમતિ ગંગાબેન પટેલે પોતાના વિચારો રજુ કરી નૂતન વર્ષાભિનંદન પાઠવેલ.

સમારોહ દરમ્યાન અલ્પાહાર તેમજ ઠંડાપીણાની વ્યવસ્થા કરવા બદલ મંત્રીશ્રીએ નાનાલાલ વી. પટેલ, શ્રી જયંતિલાલ એન. પટેલ શ્રી ગૌતમ એસ. પટેલ શ્રી કરમશી એમ. પટેલ તથા શ્રી ખટાઉ કે પટેલના કાર્યની કદર કરી ઉપસ્થિત ભાઇ-બહેનોનો ફરીથી આભાર માની અતિ હર્ષોલ્લાસ ના વાતાવરણ વચ્ચે સમારોહ પૂર્ણ થયેલ જાહેર કરેલ.

લી.

શ્રી નવચેતન પાટીદાર યુવક મંડળ
શ્રી રતનશી લધારામ પટેલ.
B. Com. [Hons] C. U.]
માનદ મંત્રી

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1152/page/n11/mode/1up

realpatidar.com

શ્રી નવચેતન પાટીદાર યુવક મંડળ કલકત્તા

શ્રી નવચેતન પાટીદાર યુવક મંડળ કલકત્તાની નવા વર્ષની પ્રથમ સાધારણ સભા 'પાટીદાર સમાજ વાડી' માં તા. ૧૫-૧૧-૮૧ને રવિવારના રોજ બપોરના ૨-૩૦ વાગ્યે મંડળના પ્રમુખ શ્રી મણીલાલ અરજણ પટેલના પ્રમુખ પદે યોજાયેલ આ સભામાં અન્ય કાર્યવાહી સહિત સંવત ૨૦૩૮ના વર્ષ માટે નવા હોદ્દેદારો તેમજ નવી કાર્યવાહક સમિતીની વરણી કરવામાં આવેલ.

સંવત ૨૦૩૮ની કાર્યવાહક સમિતિ

૧	પ્રમુખશ્રી	૦ શ્રી મણીલાલ અરજણભાઇ પટેલ
૨	ઉપ-પ્રમુખ	૦ શ્રી જેઠાલાલ કાનજીભાઇ પટેલ
૩	મંત્રી	૦ શ્રી રતનશી લધારામ પટેલ B.com (Hons;
૪	સહમંત્રી	૦ શ્રી ગૌતમભાઇ સોમજી પટેલ
૫	કોષાધ્યક્ષ	૦ શ્રી નારણભાઇ ખેતાભાઇ પટેલ
૬	સહ-કોષાધ્યક્ષ	૦ શ્રી નાનાલાલ વાલજીભાઇ પટેલ
૭	સભ્ય	૦ શ્રી તુલસીદાસ કેશરાભાઇ પટેલ
૮	,,	૦ શ્રી ધનજીભાઇ મનજીભાઇ ,,
૯	,,	૦ શ્રી નાનાલાલ પ્રેમજીભાઇ પટેલ B com
૧૦	,,	૦ શ્રી લાલજીભાઇ સામજીભાઈ પટેલ
૧૧	,,	• શ્રી ધનજીભાઇ મુળજીભાઇ પટેલ
૧૨	,,	૦ શ્રી કરમશીભાઇ માવજી પટેલ
૧૩	,,	૦ શ્રી દિનેશકુમાર દાનાલાલ પટેલ
૧૪	,,	૦ શ્રી જયંતીલાલ નારણભાઈ પટેલ
૧૫	,,	૦ શ્રી જયંતીલાલ કરશનભાઇ પટેલ
૧૬	,,	૦ શ્રી અમૃતલાલ વેલજીભાઇ પટેલ
૧૭	,,	૦ શ્રી ભવાનજી રામજીભાઈ પટેલ
૧૮	,,	૦ શ્રી કાન્તીલાલ સીવગણભાઇ પટેલ
૧૯	,,	૦ શ્રી વીશ્રામભાઇ નાનજીભાઈ પટેલ
૨૦	,,	૦ શ્રી જયંતીલાલ રામજીભાઇ પટેલ
૨૧	,,	૦ શ્રી જયંતીલાલ રતનશી પટેલ
૨૨	,,	૦ શ્રી શાન્તીલાલ હંસરાજ પટેલ
૨૩	,,	૦ શ્રી પ્રભુદાસ મનજીભાઇ પટેલ

લી. નવચેતન પાટીદાર યુવક મંડળ
શ્રી રતનશી લધારામ પટેલ
માનદ મંત્રી

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n12/mode/1up

1981-12 -Jagruti (1152)

realpatidar.com

જબલપુર તથા રાજનાંદગાંવના અમુક કાર્યકરો દ્વારા ઊભો કરાયેલો વિવાદ

મુંબઈના સંબંધિત કાર્યકરોનો ખુલાસો

ઉલ્લેખિત વિવાદ નિરર્થક ઉપસાવવામાં આવ્યો છે

આપણા કોઈ એક ક્ષેત્રના સામાજિક કાર્યકરો જ્યારે પણ બીજા ક્ષેત્રમાં પહોંચે ત્યારે ત્યાં સ્થાનિક સમાજના કાર્યકરોનો અને જો સભા બોલાવવામાં આવે તો તેના દ્વારા તે સમાજનાં ભાઈ-બહેનોનો સંપર્ક સાધી વિચારોનો સામાજીક દ[illegible]વિનિમય કરે તે કેવળ યોગ્ય જ નહિ પણ આવશ્યક ગણાવું જોઈએ.

સામાજીક સ્તરે થતા પારસ્પારિક પરિચય વડે કશું ગુમાવવાનું હોતું જ નથી, બલ્કે ફાયદા જ થતા હોય છે જેવા કે :- (૧) કાર્યકરોમાં રહેલી માનસિક કુપમંડુકતા દૂર થાય છે. (૨) પોતપોતામાં રહેલી ત્રુટીઓનું ભાન થાય છે અને (૩) લોકોપયોગી સામાજીક પ્રવૃત્તિ હાથ ધરવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે વગેરે.

જબલપુર મધ્યે (૧) સમાજના સમાગમ માટેની વિનંતી કરાયા છતાં તે તરફ દુર્લક્ષ સેવવામાં આવેલું તેથી અને (૨) ત્યાંના વર્તમાન હોદેદારોની શીથીલતાને કારણે સામાજીક પ્રવૃત્તિ શૂન્યવત્ જણવામાં આવતાં તેમજ (૩) આગંતુક સામાજીક કાર્યકરો પોતાની 'પોલ' જાણી ગયા બદલ જાહેરમાં વ્યકત કરાયેલા ખેદ દ્વારા અભીપ્રેત પરાયાપણાની લાગણીનો અનુભવ થતાં અમને દુઃખ થયું. આ ઉપરાંત (૪) સમાજ અને યુવકમંડળ એટલે કે વડીલો અને યુવાપેઢી વચ્ચે અપુર્વ ગર્તા દેખાઈ જે પણ ખરેખર દુઃખકર છે. આવાં સામાજીક અનિષ્ટો, કોઈ પણ કાર્યકરને, જો નજરે ચડે તો સંતાપે જ તેમાં બે મત હોઈ જ ન શકે.

રાજનાંદગાંવમાં તો સામાજીક સમાગમ માટેની લેખીત માગણીનો, બે વાર પાછી મોકલાવી, અસ્વીકાર કરવામાં આવ્યો. કારણ માટે જીજ્ઞાસા થતાં સ્થાનીક વડીલોનું અરસપરસનું વલણ કેટલું વૈમનસ્યભરેલું છે તે સમજાયું. તેવા સંજોગોમાં સામાજીક કાર્ય થઈ પણ કેમ શકે ? **किं बहुना** । આપણા સમાજના કાર્યકરો જાતે કાર્યરત થાય અથવા ધગશવાળા જ્ઞાતીબંધુઓને કે ઉત્સાહી યુવકોને સામાજીક હીતાર્થ કાર્યકરવાની તક આપે એ હેતુસર કેવળ હકીકત જાહેર કરી છે. આમાં અંગત રાગદ્વેષ અથવા સમાજ-સમાજ વચ્ચેના કહેવાયેલા કોઈ નાજુક સંબંધો નો પ્રશ્ન જ નથી. હકીકતની રજુઆત સામે સ્વબચાવ રૂપે જે મરોડ આપવામાં

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 11 of 28

realpatidar.com

આવ્યો છે તે ઠીક નથી. વૈચારીક સંકુચીતતા દૂર થવી જ જોઈએ. દોષારોપણ લાગ્યું હોય તો કાર્યદ્વારા તે ખોટું સિદ્ધ કરી બતાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો હીતકર થશે.

આમાં મુંબઈ-સમાજ સાથે ચર્ચા કરી બતાવવાનો કોઈ સવાલજ નથી, એ મુલાકાત તે સમાજ તરફથી ગોઠવવામાં આવી જ ન હતી.

આ પ્રસંગે આપણા રાયપુર સમાજનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. ત્યાંનાં કાર્ય અને કાર્યપધ્ધતિમાં જવાબદારીની સંપૂર્ણ સભાનતા, દૃઢ સંગઠન અને સામાજીક ઉન્નતિની અદમ્ય ભાવના સહેજે દેખાઈ આવ્યાં હતાં. જે અતિ પ્રશંસનીય છે. માનસપટ પર સુંદર છાપ ઉપસી છે અને અમને કેટલુંક ત્યાંથી શીખવા મળ્યું સાંપડયું છે.

અસ્તુ. અલં વિસ્તરેણ ।

આપના વિશ્વાસુ,

મુળજીભાઈ પટેલ, ઉપ-પ્રમુખ

માવજીભાઈ ધનજીભાઈ પટેલ, મંત્રી

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ (મુંબઈ)

✻ શ્રી નવરાત્રિ મિત્રમંડળ ✻

શ્રી પાટીદાર નવરાત્રી મિત્ર મંડળની વાર્ષિક સભા મંડળના પ્રમુખશ્રી જેઠાભાઈ વેલજીભાઈના પ્રમુખ સ્થાને મળેલ, જેમાં મંડળનો વાર્ષિક અહેવાલ તેમજ આવક જાવકનો હિસાબ રજુ કરવામાં આવ્યો. મંડળની કારોબારીના સ્થાને ટ્રસ્ટ બોર્ડને કાયમીલ કરવાનો અને નવા ટ્રસ્ટી સ્ટુડીઓને તેમજ હોદ્દેદારોને ચુંટવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો જેમાં નીચેના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓને ચુંટવામાં આવ્યા. આ ટ્રસ્ટબોર્ડ ૪ વર્ષ સુધી કાર્ય કરશે.

નવા ચુંટાયેલા ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટબોર્ડના હોદ્દેદારો.

૧. શ્રી જેઠાભાઈ વેલજીભાઈ	ચેરમેન
૨. શ્રી વીશ્રામભાઈ હંસરાજભાઈ	વાઈસ ચેરમેન
૩. ,, મગનલાલ ગંગારામ	સેક્રેટરી
૪. ,, દાનાભાઈ દેવસીભાઈ	જોઈન્ટ સેક્રેટરી
૫. ,, વાલજીભાઈ દેવજીભાઈ	ખજાનચી

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n14/mode/1up

realpatidar.com

૬ શ્રી	વાલજીભાઈ હરજીભાઈ	ટ્રસ્ટી
૭. ,,	રામજીભાઈ પ્રેમજીભાઈ	,,
૮. ,,	માવજીભાઈ વિશ્રામભાઈ	,,
૯. ,,	કરશનભાઈ જેઠાભાઈ	,,
૧૦. ,,	લધારામ શીવજીભાઈ	,,
૧૧. ,,	ભીમજીભાઈ વિશ્રામભાઈ	,,
૧૨. ,,	બબુભાઈ કારીઆ	ખાસ આમંત્રિતો
૧૩. ,,	પેથાલાલ માવજીભાઈ	
૧૪. ,,	રતનશીભાઈ લધારામ	ઓડીટર

મંત્રી

શ્રી પાટીદાર નવરાત્રી મિત્ર મંડળ

કલકત્તા

✱ નવચેતન યુવક મંડળ—શેરપુર ✱

તા. ધોળકા જિ. અમદાવાદ.

અમારા ઉપરોકત મંડળની સામાન્ય સભા તા. ૨૮–૧૦–૮૧ના રોજ શેરપુરા સમાજ મંદિરમાં મળેલ ૧૯૮૦–૮૧ ની વર્ષની કાર્યવાહી તેમજ હિસાબની ચર્ચા કરવામાં આવેલ અને તેને બહાલી આપવામાં આવેલ તેમજ નીચેની કારોબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ.

પ્રમુખ— અંબાલાલ એસ. પટેલ

મંત્રી— ડાહ્યાભાઈ એસ. પટેલ

કારોબારી સભ્ય :— (૧) જયંતિલાલ દેવસીભાઈ પટેલ
(૨) પરસોત્તમ એતાભાઈ પટેલ
(૩) શાંતિલાલ વાલજીભાઈ પટેલ
(૪) પરસોત્તમ દેવશીભાઈ પટેલ (સુરત)
(૫) મણિલાલ પુંજાભાઈ પટેલ
(૬) ગોવિંદભાઈ જીવરાજભાઈ પટેલ (અણુભાઓ)
(૭) જીવરાજભાઈ દેવશીભાઈ પટેલ (કુનૈત)
(૮) કાન્તિલાલ વાલજીભાઈ પટેલ
(૯) રમણલાલ કરમશીભાઈ પટેલ

ત્યાર બાદ નવા વર્ષે કરવાનાં વિકાસનાં કાર્યોની સમીક્ષા તેમજ અન્ય ચર્ચાઓ પ્રગતિને લગતી કરવામાં આવેલ અને જરૂરી ઠરાવો કરી સભા પૂરી કરવામાં આવેલ

મંત્રી

ડાહ્યાભાઈ શામજીભાઈ પટેલ

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n15/mode/1up

1981-12 -Jagruti (1152)

realpatidar.com

* શ્રી તખતગઢ યુવક—મંડળ *

સાબરકાંઠા જીલ્લાના તખતગઢ (હડમતીયાકંપા)માં શ્રી તખતગઢ યુવકમંડળની સાધારણ સભા મંડળના માજી પ્રમુખ શ્રી કાંતિભાઈ અ. પટેલના પ્રમુખસ્થાને મળી હતી. જેમાં ત્રણ વર્ષ માટે નીચે જણાવેલ હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી:

પ્રમુખ— શ્રી ચંદુલાલ વેલજીભાઇ પટેલ
ઉપપ્રમુખ— શ્રી હરિભાઇ એલ. પટેલ
મંત્રી— શ્રી વિઠ્ઠલભાઈ કે. પટેલ
સહમંત્રી— શ્રી મોહનભાઇ આર. પટેલ
ખજાનચી— શ્રી વિઠ્ઠલભાઇ એલ. પટેલ
ઓડિટર— (૧) શ્રી હરિભાઇ જે. પટેલ
(૨) શ્રી જયંતિભાઇ કે. પટેલ

સમિતિઓ :—

(૧) વાસણ વ્યવસ્થા :– (૧) શ્રી જીવરાજભાઈ જે. પટેલ
(૨) શ્રી અંબાલાલ આર. પટેલ

(૨) સ્મશાન વ્યવસ્થા :– (૧) શ્રી અરજણભાઇ, એ. પટેલ
(૨) શ્રી રતિલાલ એસ. પટેલ

નવા વરાયેલા પ્રમુખશ્રી ચંદુલાલ વે. પટેલે પોતાની પ્રમુખ તરીકેની સર્વાનુમતે વરણી કરવા બદલ યુવક મંડળના સર્વે સભ્યોનો હાર્દિક આભાર માન્યો હતો. અને સભ્યોના સાથ સહકારથી મંડળની ઉન્નતિ માટે ધ્યેય સિધ્ધ કરવા પોતાની ફરજ અદા કરવાની ખાત્રી આપી હતી.

મંડળના મંત્રીશ્રી વિઠ્ઠલભાઇ પટેલે મંડળના વિકાસ અંગેનો અહેવાલ આપ્યો હતો, અને નવા વર્ષે મહિલા સિવણ કલાસ, રમતગમત સ્પર્ધા વિગેરે શરૂ કરવા માટેની દરખાસ્ત મૂકી હતી. અંતે શ્રી મોહનભાઇ પટેલે આભારવિધિ કરી હતી.

ગણપત વી. પટેલ,
એડવોકેટ, તખતગઢ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 14 of 28

https://archive.org/details/bk1152/page/n16/mode/1up

realpatidar.com

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ

સંચાલિત

શ્રીમતી રૂડબાઈ રતિલાલ પટેલ (મોતીપુરાવાળા)

કન્યા છાત્રાલય-મોડાસા

કન્યા છાત્રાલય મોડાસાના લાભાર્થે એક સપ્તાહનું આ આયોજન વૈશાખ સુદ ૧૦ને રવિવારનું રાખેલ છે. અને બીજુ સ્પેશ્યલ ટ્રેન ત્રણ ધામ યાત્રા પ્રવાસ, (ડાકોર, ગોકુલ, મથુરા, દિલ્લી, હરદ્વાર, કાશી, કલકત્તા, જગન્નાથ, તીરૂ-પતિ બાલાજી, મદ્રાસ, બેંગલોર, રામેશ્વર, પંઢરપુર, નાશિક, મુંબઈ) વગેરે સદર ટ્રેન મહાવદ અને ફાગણ માસમાં રાખવામાં આવેલ છે. જેનું બુકીંગ દશેરાથી ચાલું કરેલ છે.

અને તે પછીથી જેમણે નામ નોંધાવવાં હોય તે ભાઈઓએ ઉપરોકત સંસ્થામાં આવી નામ નોંધાવી જવાં

આભાર સહ

ખી. પ્રે. પટેલ, પ્રમુખ

સાબરકાંઠા જીલ્લા સૉ મીલ એસોશીએશન

ઓફીસ : હિંમતનગર

આપણા જીલ્લામાં સો મીલનો ધંધો કરતા ભાઈઓનું એક એસોશીએશન વર્ષોથી ચાલે છે. સદર એસોશીએશનની મીટીંગ ચાલું વર્ષે તા. ૬-૧૧-૮૧ ના રોજ શામળાજી મુકામે મળી હતી. સો મીલના ધંધા અંગે પડતી મુશ્કેલીઓ તેમજ સંગઠ્ઠન મજબુત બને તેવાં પગલાં ભરવા માટે પ્રમુખશ્રી તરફથી રજુઆત કરવામાં આવી હતી.

નવા વરસે પણ નીચે દર્શાવેલ ભાઇ ઓને તેમના હોદ્દા પર જ ચાલુ રાખવામાં આવ્યા છે.

પ્રમુખ : શ્રી મુળજીભાઇ કરશનભાઇ પટેલ, તલોદ (શ્રી અંબીકા સો મીલ)
મંત્રી : શ્રી જીવરાજભાઇ ધનજીભાઈ પટેલ, વડાલી (પટેલ સો મીલ)

મીટીંગના અંતે શામળાજી મંદિરમાં ભગવાનનાં દર્શન કરીને ભોજન લીધા બાદ મીટીંગનું કામકાજ પુરુ કર્યું હતું.

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n17/mode/1up

realpatidar.com

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દિલ્હી

'નવા વર્ષની કારોબારીની રચના'

અત્રેશ્રી રવિલાલ પટેલ શ્રો મીલ કિર્તિનગરમાં સમાજની વાર્ષિક સામાન્ય સભા તા. ૧૫-૧૧-૮૧ ના રોજે સમાજના પ્રમુખ નાનજીભાઇ હિરાલાલના પ્રમુખ સ્થાને રાખવામાં આવી હતી જેની અંદર ગત મીટીંગની મીનીટ્સનું વાંચન, મંત્રીશ્રી રતનશીભાઇ હંસરાજ તરફથી કરવામાં આવેલ હતું અને ખજાનચી શ્રી સોમજી-ભાઈ મુલજી તરફથી ગત વરસનો આવક-જાવકનો હિસાબ રજુ કરવામાં આવેલ જે સર્વસંમતિથી બહાલ કરવામાં આવેલ ત્યાર બાદ ગયા વરસના હોદ્દેદારોએ રાજીનામું આપ્યા બાદ કાર્યવાહક ચુનાવ તરીકે વડીલશ્રી વિસરામ સીવદાસ પટેલની દેખરેખ હેઠળ નવા વર્ષ સંવત ૨૦૩૮ માટે નીચે મુજબ "કારોબારી સમિતિ"ની રચના કરવામાં આવેલ.

પ્રમુખ :— શ્રી વિસરામ હંસરાજ પટેલ
ઉ. પ્રમુખ :— શ્રી સોમજી મુળજી પટેલ
મંત્રી :— શ્રી કરસન વિસરામ પટેલ [કવિ]
સ. મંત્રી :— શ્રી પરબત કરસન પટેલ
ખજાનચી :— શ્રી રવજીભાઇ ખીમજી પટેલ

સલાહકાર સમિતિ :—

૧. શ્રી નાનજીભાઇ હીરાલાલ પટેલ
૨. શ્રી વેલજીભાઇ દેવસીભાઇ પટેલ
૩. શ્રી લખમશીભાઇ નાનજીભાઇ પટેલ
૪. શ્રી કરસનભાઇ કાનજી પટેલ
૫. શ્રી દેવશી સોમજી પટેલ
૬. શ્રી ભીમજી નાનજી પટેલ
૭. શ્રી ગંગારામ હીરાલાલ પટેલ
૮. શ્રી રતનશીભાઇ હંસરાજ પટેલ

ચુનાવ સંપૂર્ણ થયા બાદ નવા હોદ્દેદારોએ પોતાનું પદગ્રહણ કરેલ અને અલ્પાહાર લીધા બાદ સભાનું વિસર્જન કરવામાં આવેલ.

મંત્રી
ક. વિ. પટેલ.
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, દિલ્હી

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n18/mode/1up

realpatidar.com

સમ્બલપુર કચ્છી કડવા પાટીદાર સમાજ

સંવત ૨૦૩૭ ના આસો વદ ૭ ને સોમવાર તા. ૧૯-૧૦-૮૧ ના સમાજની વાર્ષિક સાધારણ સભા "પાટીદાર ભવન"માં યોજવામાં આવેલ અને નિમ્નલિખિત હોદેદારોને સં. ૨૦૩૮ ના વર્ષ માટે ચુંટવામાં આવેલ છે.

પ્રમુખ. શ્રી ધનજી પુંજા ખેતાણી
ઉપ પ્રમુખ. શ્રી હરજી ગોપાલ ભાવાણી
મંત્રી. શ્રી મંગલદાસ પ્રેમજી ખેતાણી
સહમંત્રી. શ્રી ગીરધરલાલ વાલજી છાભૈયા
હિસાબનીશ. શ્રી શીવજી સામજી ખેતાણી
ખજાનચી. શ્રી જાદવજી ગોપાલ છાભૈયા

કાર્યવાહક સમિતિ

શ્રી રતનશી નારણ પોકાર
શ્રી ગોપાલ કાનજી ખેતાણી
શ્રી અબજી પ્રેમજી રામાણી
શ્રી પ્રવિણકુમાર કાનજી દિવાણી
શ્રી વિશ્રામ પરબત છાભૈયા
શ્રી નાગજી ભીમજી ભીમાણી
શ્રી ભીમજી ધનજી ખેતાણી

મંત્રી
મંગલદાસ પ્રેમજી ખેતાણી
સમ્બલપુર કચ્છી કડવા પાટીદાર સમાજ

卐 卐

શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ વિશાખાપટ્ટનમ

વિશાખાપટ્ટનમ્ તા. ૧૫-૧૧-૮૧ અહીં શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજની એક સામાન્ય જનરલ સભા નરસીંહા સો મીલમાં બોલાવવામાં આવેલ સમાજના કાર્યક્ષેત્રમાં વિશાખાપટ્ટનમ્ અનકાલ્લી- પાયગરાપેટા નો સમાવેશ કરતાં કુલ ૯૧ સભ્યોએ સભ્યપદ મેળવ્યું છે. જેમાં નવા વર્ષના હોદેદારો તેમજ ૧૧ કારોબારી સમિતિના સભ્યોને સર્વાનુમતે ચુટી કાઢવામાં આવેલ છે.

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n19/mode/1up

realpatidar.com

૧	પ્રમુખ—	શ્રી ડાયાલાલ વિરજી પટેલ	અનકાપલી	(કાદિયામોટા)
૨	ઉ. પ્રમુખ—	,, જીવરાજ શીવગણ ,,	વિશાખાપટનમ્	(કોડકી [જ
૩	મંત્રી—	,, ખીમજી રતનશી ,,	,,	[કાદીયા નાના]
૪	સ. મંત્રી—	,, નારણ જેઠા ,,	,,	(રવાપર)
૫	ખજાનચી—	,, ગોપાલ દેવજી ,,	,,	(રસલીયા)
૬	સ. ખજાનચી—	,, માવજી ગંગદાસ ,,	,,	(કોટડા(જ)
૭	ઓડીટર—	,, સોમજી વિરજી ,,	,,	(નાગવીરી)
૮	સ. ઓડીટર—	,, મુકુન્દરાય સોમજી ,,	,,	(ખીરસરા(નેત્રા)
૯	સલાહકાર—	,, લાલજી વેલજી ,,	,,	(ધાવડા)
૧૦	સલાહકાર—	,, મણીલાલ લધારામ ,,	,,	(વિરાણી)

ઉપર મુજબ હોદ્દેદારોએ સભામાં પદ ગ્રહણ કરી સર્વે ભાઇઓનો આભાર માનેલ અને આવતા વર્ષમાં સર્વે સાથે મળી સામાજીક કાર્યો કરવા અપીલ કરેલ ત્યારબાદ જલપાન કરી રાષ્ટ્રગીત ગાઇ સભા બરખાસ્ત કરેલ.

લિ. મંત્રી
ખીમજી રતનશી પટેલ
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ વિશાખાપટ્ટનમ

શ્રી કચ્છ કડવા પાટીદાર વિદ્યાર્થી મંડળ

અમદાવાદ

નવા વર્ષની પ્રથમ સામાન્ય સભા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજવાડી (અમદાવાદ)માં મળી મોટી સંખ્યામાં નવા તથા જૂના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ભાગ લઇ હાજર રહયા.

આ સભામાં સર્વાનુમતે નવી કારોબારીની રચના કરવામાં આવી હતી.

કારોબારી સમિતિ ૧૯૮૧–૮૨

પ્રમુખ—શ્રી છબીલદાસ એન. પટેલ (ટી. વાય બી. એ.) રાયણનો માળ કંપા
ઉપ પ્રમુખ– શ્રી કેશવલાલ એસ. પટેલ (એમ. કોમ.) જશવંતપુરા કંપા.
મંત્રી– ,, મહેન્દ્રકુમાર એસ. પટેલ (ટી વાય. બી.કોમ લાલુકંપા
સહમંત્રી– ,, કુ. હંસાબેન પી. પટેલ (ટી. વાય. બીએ.) ધરમેડા કંપા
ખજાનચી– ,, નવનીતલાલ એન. પટેલ (એમ. કોમ.) વિષ્ણુપુરા કંપા

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n20/mode/1up

realpatidar.com

પ્રવાસમંત્રી–૧. શ્રી જયંતિલાલ આર. પટેલ ટી. વાય.બીએ. નવા નગરકંપા
૨. ,, ગોપાલ ડી. પટેલ (એસ.વાય.બી. કોમ.) દુર્ગાપુર (કચ્છ)
૩. ,, ઘનશ્યામ ટી. પટેલ (એફ.વાય. બી. એ) અદામકંપા

સ્વાગત મંત્રી ૧. કુ. જયોતિબેન પી પટેલ (એસ.વાય.બી.એ.) ધરમેડા કંપા
૨. શ્રી પ્રમોદકુમાર કે. પટેલ (ટી. વાય બી.એ) શીવપુરાકંપા

રમતગમત મંત્રી૧. શ્રી ગંગારામ બી. પટેલ (એસ. વાય બી.કોમ) જીયાપુર (કચ્છ)
૨. શ્રી વિનુભાઇ ડી. પટેલ (એસ.વાય.બી.કોમ) માતાજીકંપા
૩. શ્રી રતિલાલ એમ. પટેલ. ટી.વાય, બી કોમ વડોદરા લાટ

વ્યવસ્થાપક મંત્રી ૧. શ્રી મનસુખ એચ. પટેલ (હાયર સેકન્ડરી) રિંગરવા
૨. શ્રી મોહનલાલ શ્રી. પટેલ (એફ.વાય.બી.એ.) કુરબઇ (કચ્છ)

વિદ્યાર્થીની પ્રતિનિધિ–કુ. સરલાબેન એન. પટેલ (એસ. વાય.બી.એ.) રાયણનો નાળ

સલાહકાર– ૧. શ્રી પ્રવિણકુમાર એમ. પટેલ
૨. શ્રી નરેન્દ્રકુમાર એમ. પટેલ
૩. શ્રી શાંતીલાલ ડી. પટેલ
૪. શ્રી રતિભાઇ ડી. પટેલ

* ● *

કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ

(ગુજરાત) વનસુરા

કારોબારી સમિતિના મુખ્ય હોદ્દેદારો

ગત તા. ૧૫–૧૧–૮૧ ના રોજ ઉપરોકત સમાજની કારોબારી સમિતિમાં નીચે મુજબના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

પ્રમુખ શ્રી દેવસીભાઇ મેઘજીભાઇ વેલાણી (મુંબઇવાળા) દહેગામ

ઉપ પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઇ કરશનભાઇ પટેલ બિલેશ્વર કંપા

મંત્રી શ્રી બહેચરભાઇ મુળજીભાઇ પટેલ મોતીસરી

સહમંત્રી શ્રી ખીમજીભાઇ સવજીભાઇ ,, એદલપુરા કંપા

ખજાનચી શ્રી જીવરાજભાઇ હીરજીભાઇ ,, ચરાદલાટ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library Page 19 of 28
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1152/page/n21/mode/1up

1981-12 -Jagruti (1152)

realpatidar.com

શ્રી દેવસીભાઈ મેઘજીભાઈ વેલાણી

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ગુજરાત, ધનસુરા સંચાલિત, શ્રીમતી આર. ડી. વેલાણી કન્યા છાત્રાલયના દાનદાતા શ્રી દેવસીભાઈ મેઘજીભાઈ વેલાણી મુળ વતન નખત્રાણા(દુર્ગાપુર ગામની ગત તા.૧૫-૧૧.૮૧ ના રોજ યોજવામાં આવેલ મીટીંગમાં લવાદ પંચદ્વારા સમાજના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. વડીલશ્રીએ વર્ષોથી ઘાટકોપર–મુંબઈમાં કોન્ટ્રાક્ટર તરીકે સારી એવી નામના મેળવેલી છે. હાલમાં દહેગામ જિ. અમદાવાદમાં ખેતીવાડી ક્ષેત્રે સક્રિય રસ ધરાવે છે તેઓશ્રી સ્વભાવે નિખાલસ, મિતભાષી, સેવાભાવી, તેમજ સૌમ્ય પ્રકૃતિ ધરાવે છે તેમના સુપુત્રો રતિલાલભાઈ, કાંતિભાઈ દામજીભાઈ તેમજ વિશ્રામભાઈ. દુબઈ કુવૈત તેમજ મુંબઈ ખાતે કોન્ટ્રાક્ટર તરીકેના વ્યવસાયમાં સારી એવી નામના મળવેલ છે.

દલપુરા કંપા પ્રાથમિક શાળાના નવા મકાનનું ઉદ્‌ઘાટન

ઉપરોક્ત કંપાની શાળાનું નવું મકાન તૈયાર થઈ જતા ગત ૧૬-૧૧-૮૧ ના રોજ સાં. કાં જિ. પંચાયત પ્રમુખ શ્રી ધીરુભાઈ પટેલના વરદ્હસ્તે ભવ્ય ઉદ્‌ઘાટન સમારોહ યોજવામાં આવેલ કંપાની નાની બાલિકાઓના સ્વાગત ગીત તેમજ પ્રાર્થના થી સમારંભના શરૂઆત કરવામાં આવી.

સમારંભના પ્રમુખ સ્થાને શ્રી નટુભાઈ ગો. પટેલ અધ્યક્ષશ્રી સા. કા. જિ. શિક્ષણ સમિતિ તેમજ અતિથિવિશેષશ્રીઓ તરીકે શ્રી શાસનાધિકારી સાહેબ શ્રી નાથાભાઈ જે, પટેલ ધારાસભ્ય શ્રી હિંમતનગર, શ્રી સામજીભાઈ એસ. પટેલ માજી પ્રમુખશ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ગુજરાત, ધનસુરા શ્રી રણજીતસિંહ જોધા મોડાસા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, રતિભાઈ એલ. પટેલ પ્રિન્સિપાલ શ્રી તલોદ સાયન્સ કોલેજ વગેરે મહેમાનોએ ઉપસ્થિત રહી સમારંભમાં મનનીય વક્તવ્યો હેડમાસ્તર શ્રી જે. એસ. મહેતા હાઈસ્કૂલ ધનસુરાએ આપી યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતું.

સભા સંચાલન શ્રી વાડીભાઈ કે. પટેલ, મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કંપા નિવાસી ભાઈઓએ પ્રાથમિક શાળા અંગેનો સંપૂર્ણ અહેવાલ વાંચન તેમજ આભાર વિધિ શ્રી અરજણભાઈ રામરામભાઈ પટેલ કરી હતી.

શ્રી ખીમજીભાઈ શીવજીભાઈ પટેલ શ્રી ખીમજીભાઈ માંનાભાઈ પટેલ શ્રી શીવજીભાઈ ધનજીભાઈ પટેલ શ્રી નાગજીભાઈ અને નારણભાઈ પુંજાભાઈ પટેલ વગેરે વડીલોના સહકારથી તેમજ કંપા નિવાસી યુવાન ભાઈઓના સંપૂર્ણ સહકારથી સભા મંડપનું આયોજન તેમજ ભોજન સમારંભનું સફળતાપુર્વક સંયોજન કરવામાં આવેલ હતું.

અભિનંદન

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n22/mode/1up

realpatidar.com

અમદાવાદમાં કાપડનો
—અદ્યતન શો રૂમ

STAPLE
EMPORIUM

સ્ટેપલ એમ્પોરિયમ.

શુટીંગ ✳ શર્ટીંગ

ગ્વાલીયર—જીયાજી
રેમન્ડ—દીનેશ—દીગ્જામ
તેમજ પ્રખ્યાત મીલોની
નવીનતમ વેરાઈટીઝ માટે
અમારા શો રૂમની અવશ્ય
મુલાકાત લો.

પ્રોપ્રાયટર
મણીલાલ એમ. પટેલ
ભગવાનદાસ એમ. પટેલ
એન્ડ બ્રધર્સ
સહયોગ ફાર્મ, શીવપુરાકંપા
હસનપુરમોટા તા. જિ. ગાંધીનગર

શો રૂમનું સ્થળ :—
સ્ટેપલ એમ્પોરિયમ
કેલીકોડોમ ઝીક
ગીર્વાફ રો અમદાવાદ-૧

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n23/mode/1up

1981-12 -Jagruti (1152)

realpatidar.com



સમય અને
મહેનત
બચાવો ❋

પોકાર

નું
ઇલેકટ્રીક પાવરથી
ચાલતું

છાસ

બનાવવા
માટેનું

વલોણા યંત્ર

—તદ્દન આધુનિક તેમજ આકર્ષક મોડેલોમાં વસાવી ઘરની શાન વધારો.

—: વિક્રેતાઓ :—

(૧) આશા ઓટોમોબાઇલ્સ ભુજ
(૨) મહાલક્ષ્મી વાઇન્ડીંગ વર્કસ ડેમાઇ
(૩) અંબિકા ફર્ટિલાઇઝર્સ ખેડબ્રહ્મા
(૪) શ્રેયસ એજન્સી રાજકોટ
(૫) હસમુખ એન્જીનીયરીંગ કું. વિસાવદર
(૬) શ્રી રામ સ્ટોર્સ નખત્રાણા
(૭) મોહનલાલ એન્ડ બ્રધર્સ વિરાણી
(૮) ખેડૂત બીજ કોર્પોરેશન ગોંડલ
(૯) પેરેડાઇઝ ઇલેકટ્રીકલ્સ મોડાસા

● ઉત્પાદક : **મે. પોકાર એન્જીનીયરીંગ કોર્પોરેશન**

૮, લલીતા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ, નાગરવેલ હનુમાન રોડ, રખીઆલ
અમદાવાદ—૩૮૦ ૦૨૩

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n24/mode/1up

1981-12 -Jagruti (1152)

realpatidar.com

"GARUD"

Phone : P. P. 351024

ગરુડ

એન્જીનીયરીંગ કોર્પોરેશન

૧૫/૧ F નીરોદ બીહારી મલીક રોડ, કલકતા—૭૦૦૦૦૬

આથી અમો સૉ મીલ તેમજ પ્લાયવુડ ધરાવતા ઉદ્યોગપતિઓને વિનંતિ કરીએ છીએ કે અમોએ ચેઈન સો મશીનરી નાવવાનું શરૂ કરેલ છે. જે આધુનિક યંત્ર યુગમાં લેબર પ્રોબ્લેમમાં સહાયરૂપ થશે.

ચાલવામાં સરળ, ચાલુ એમરીમાં ચેઈન ધાર કરી શકાશે, પાર્ટની પ્રચુરતા માટે ઓર્ડર નોંધાવવા આથી વિનંતી કરીએ છીએ.

સો મશીનના મદ્રાસ ટ્રોલીના પાર્ટ્સ તેમજ બેરીંગ વગેરેની માહિતી આપને મેળવી આપીશું આપની વધારે માહિતિની જરૂરીયાત માટે નજીકના એજન્ટ સાથે સંપર્ક સાધવા વિનંતી.

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n25/mode/1up

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n26/mode/1up



realpatidar.com
realpatidar.com

https://archive.org/details/bk1152/page/n27/mode/1up

realpatidar.com

-: સો મીલ માંલીકો માટે ખુશ ખબર :-

sharpex®

"શાર્પેક્ષ" બ્રાન્ડ ચેઈન સો મશીન

ચેઈન સો મશીન જે પાવરથી ચાલતા આડિયા તરીકે સર્વ માન્ય છે. જે બે માણસોની સહાયથી આડા વાઢ કાપવા માટે ઘણું અનુકુળ છે. જે સંપૂર્ણ વિદેશી ટેકનીકલ જાણકારી અને વર્ષોના અનુભવ પછી તૈયાર થયેલ છે. જેમાં કાંઈ બગડવાનું કે રીપેર કરવાનું રહેતું નથી.

આપ એક વખત "શાર્પેક્ષ બ્રાન્ડ ચેઈન સો મશીન" વસાવો અને રોકાણથી અનેક ઘણું વળતર મેળવો.

બનાવનાર :

શાર્પેક્ષ એન્જીનીયરીંગ વર્કસ

એસ. ૧૨૯/૧૩૦ જી. આઈ. ડી. સી. એસ્ટેટ,
ઓઢવ (અમદાવાદ) ૩૮૨૪૧૫

- શ્રી ભારત સો મીલ ગીતામંદિર, અમદાવાદ-૨૨
- શકિત એન્જીનીયરીંગ વર્કસ હરિપાપુર ટાવર સામે, અમદાવાદ-૧
- ભારત ટીમ્બર માર્ટ નરોડા રોડ, અમદાવાદ.
- ભારત વુડ વર્કસ ગીતામંદિર, અમદાવાદ-૨૨ નો એન્જીનીયરીંગ વિભાગ

વધુ પુછ પરછ અને માહિતી માટે
મળો યા લખો:
શ્રી ભારત સો મીલ
વિભાગ ત્રણની સામે, ગીતામંદિર,
લાટી બજાર, અમદાવાદ-૨૨
ફોન નં. ૫૨૨૫૭ અને ૮૨૨૪૩

realpatidar.com

realpatidar.com

તમારા પાક ને બચાવવો એ તમારા હાથનીજ વાતછે

ઝડપી અને અસરકારક રીતે જીવાતને અંકુશમાં લાવી લાંબો સમય રક્ષણ આપનાર આ જંતુનાશક વાપરી ગાભમારાની ઈયળ, મશી, ચુસિયાં, પાનકથીરી, કુદકિયાં ફળમાખી, થ્રીપ્સ વિગેરેથી ડાંગર, મગફળી, તમાકુ, કપાસ શેરડી. શાકભાજી તથા ચા, કોફી જેવા પાકનું રક્ષણ કરો.

Paushak પૌષક લિમિટેડ એલેમ્બિક રોડ, વડોદરા–390 003

સ્ટોકીસ્ટ :—

મે. ઘનશ્યામ ફર્ટીલાઈઝર. ગાબટ રોડ, બાયડ.

મે. કિશાન ટ્રેડર્સ., એસ ટી. ડેપા પાસે, મોડાસા

મે પટેલ ફર્ટીલાઈઝર ટ્રે. કું. સ્ટેશનરોડ, હિમતનગર.

મે અમર ફર્ટીલાઈઝર, સહકારી સંઘ સામે ઈડર,

realpatidar.com

https://archive.org/details/bk1152/page/n29/mode/1up

1981-12 -Jagruti (1152)

realpatidar.com

JAGRUTI DECEMBER-'81 Reg. No. GHMR/5

શ્રી. નં.

રવાના :
જાગૃતિ કાર્યાલય
પટેલવાડી, તલોદરોડ,
ધનસુરા, જિ. સાબરકાંઠા
પીન. ૩૮૩૩૧૦

Book – Post

To.

પ્રકાશક :
શ્રી. વિશ્રામભાઈ એન. પટેલ
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
યુવક મંડળ (ગુજરાત)
"જાગૃતિ કાર્યાલય"
પટેલવાડી, તલોદ રોડ,
ધનસુરા, જિ. સાબરકાંઠા.

મુદ્રક :
શ્રી કાન્તિભાઈ કે. પટેલ
અનુપમ પ્રિન્ટિંગ પ્રેસ
હાઈસ્કૂલ સામે, તલોદ રોડ,
ધનસુરા, જિ. સાબરકાંઠા.

realpatidar.com